

શ્રી બાલાસિનોર નવયુવક સંઘ પ્રકાશિત



# જયોતિ પુંજ

ઇટક નકલ રૂ. ૧/-

‘સપ્ટેમ્બર ૨૦૦૪’


## ઉંબરા

આપણી રોજિંદી જીવનની કેટકેટલી ઘટનાઓના મૂક સાક્ષી તરીકે ઉંબરો છે. ઉંબરો સ્થૂળ રીતે કદમાં નાનો મોટો હોઈ શકે. પરંતુ સભ્યતાના પ્રતીક તરીકે તેનું મહત્વ ઓછું નથી.... ઘરના સ્વજનો વચ્ચે ક્યારેક સામાજિક પ્રતિષ્ઠા નંદવાય ત્યારે ઘરની વાત ઉંબરાની બહાર જવા દેવાય નહીં. જે લોકો નાદાન છે તેઓ ઘરની વાત બીજાના ઉંબરે જઈને કરે છે. તે લોકો પછી કદીય ગૌરવથી માથું ઉંચુ કરી શકતા નથી. બહારની વાત બહાર રાખો અને અંદરની વાતો અંદર રાખો, તમારું સુખ બેળસાળિયું ન બનાવો - ઘરતીનો છેડો ઘર છે. દુનિયા ભરનો પ્રવાસ કરીને આવેલો માણાસ જ્યારે પોતાના ઘરના ઉંબરે પગ મૂકે છે. ત્યારે ‘હાશ’ શબ્દ દ્વારા નિરાંતનો અનુભવ કરે છે. ઘરનો ઉંબરો ત્યારે કેટલો લ્હાલો લાગે છે. ક્યારેક હતાશ થયેલો માણાસ પોતાના ઘરનો ઉંબરો ત્યજુને નીકળી પડે છે ત્યારે અનેક જાતની સમરયાઓ અને સવાલો તેને ધેરી વળે છે. માટે ઉંબરાની “ઉપેક્ષા” નહીં પણ “ઉપાસના” કરો એમાજ પરિવારનું કટ્યાએ છે.

- સંકલન

# શ્રી બાલાસિંહોર નવયુવક સંઘ (ઉપનગર વિભાગ)

બાલાસિનોર નવયુવક સંઘ (ઉપનગર વિભાગ) આયોજણ



તારીખ : ૧૧.૧૧.૨૦૦૪ને રવિવારે સાંજે ૫.૩૦ કલાકે

સ્થળ :

સ્ટે. ફાન્સીસ હાઈસ્કૂલ મંડપેશ્વર રોડ, માઉન્ટ પોઇસર રોડ,  
ભગવતી હોસ્પિટલ પાંચ બોરીવલી (વેસ્ટ)

ઉમર પ્રમાણે ગૃહ્ય પાડી બેચ આપી રમાડવામા આવાં  
ડીસીશન ફાઈનલ ગણાશે તથા તે જ દિવસે મણીબેન મ  
વિતરણ કરવામાં આવશે. ઈંગ્લીશ તથા ગુજરાતી મિડિઝિન



શાસ્ત્રી રમતાર ઓક્ટોબર  
૨૦૦૪ નાના શક્ષાણિક પારીતોષક  
મેર કરી ઠનામ આપવામાં આવશે.

નોંધ : ૭ વાગ્યા પછી આવનારને નંબર બેચ આપવામાં નહીં આવે

સંયોજક  
હેમન્ડ શાહ

તંત્રી  
પ્રદીપ કડકીએએ

પ્રમુખ  
અસીત દેસાઈ

મણીબેન મણીલાલ શાહ (આટ) પુલસ્કૃત શૈક્ષાણિક પારીતોષક માટે રીઝિટની કોપી (તમારા ઘરનો  
ફોન નંબર અને સરનામું પાછળ લખી) ઉપનગરના નજીદીકના કાર્યકરને ત્યાં તારીખ ૧૦.૧૦.૦૪ ને  
રવિવાર પહેલા મોકલી આપવી

સંયોજક  
હેમન્ડ શાહ

સી/૩૦૨, સુમેરનગર, એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૨

Tel. : ૨૮૦૫૦૭૩૫

# જ્યોતિ પુંજ



| વર્ષ | અંક | તારીખ     |
|------|-----|-----------|
| ૪૭   | ૬   | ૧૪-૮-૨૦૦૪ |

ઇટક કીમત : રૂ.૧/- વાર્ષિક લવાજમ : રૂ.૧૦/-

નિખિલ પરીખ (તંત્રી)

જતીન ન. દેસાઈ / ચેતન કાં. મોદી

શ્રીમતી શીઠા મુ. ગાંધી (S.E.O.)

નિકેશ જ. ગાંધી

પત્રવ્યવહારનું જરનામું

નિખિલ પરીખ (ફોન : ૨૩૮૨ ૨૫ ૧૦)

વીલગ્રીન કોમર્શિયલ કોરપોરેશન  
૬, ખોખા બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૩.

ફોન : ૨૪૪૪ ૮૮૯૬ • ૨૪૪૪ ૮૮૨૮

\*

મંત્રી : પ્રદીપ કડકીઆ

અંદ્રેશ એન્ટરપ્રાઇસ કોરપોરેશન, ૧૭, દેવકરણ મેન્શન,  
પાઠક વાડી, લોહાર ચાલ, મુંબઈ- ૪૦૦ ૦૦૨.

ટે.(ઓ.) : ૨૨૦૯૮૮૮૮૮૮/૨૨૦૯૯૯૮૫૪

(ધર) : ૨૨૬૬૫૭૬૮ (મોબાઇલ) : ૯૮૯૮૩૮૮૪૮૪

\*

: કાર્યક્રમ :

૧૧૮/૧૨૦, અરદ્ધશરદાદી સ્ટ્રીટ, વી.પી. રોડ,  
મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે.ન. : ૨૩૮૮૭૦૦૬

: સમય :

સોમવાર થી શનિવાર ઉંચી ૮.૩૦ (સાંજે)  
રવિવાર ૮.૩૦ થી ૧૧.૦૦ (સવારે)

visit us at [www.balasinor.org](http://www.balasinor.org)

# Generation Gap

તંત્રીસ્થાનેથી

Come on dad Stop this Aa, Aa, Aa how can you enjoy Such a bore Music 'તારા ધોધાટીયા કળકળાટ કરતાં સારું છે, અમારું શાસ્ત્રીય સંગીત રોજ સવારે મોટે મોટેથી સમજ ન પડે એવી ગાળો સાંભળીને હાથ હલાવે છે. એનું કંઈ નહો.'

આ અને આના જેવા કેટલાંક સંવાદો આપણે દરેક ઘરમાં ઘણીવાર સાંભળીએ છીએ. દરેક નવા Generation ને પોતાના વડીલો પઢાત અને વેદીયા લાગે છે, જુનવાળી લાગે છે, અને દરેક વડીલોને પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો પાસે યુવાનો ઉછાંછળા, અસભ્ય અને નાદાન લાગે છે. આ Generation Gap દાદા દાદી અને પૌત્ર-પૌત્રી વચ્ચે તો ખૂબ જ વધી જાય છે પૌત્ર, પૌત્રીઓને તો દાદા દાદી 'Gap' જેવા જ લાગે છે.

આ Generation Gap વર્ષોથી ચાલતો આવ્યો છે અને ચાલતો રહેવાનો. જમાનો જે ઝડપથી બદલાય છે, એ ઝડપથી આ Gap પુરવો શક્ય નથી. પરંતુ બન્ને પણ થોડી સમજદારીપૂર્વક વિચારવામાં આવે અને વર્તવામાં આવે તો આ Gap ઓછો જરૂર કરી શકાય છે. ચાલો આપણે બને પણ વિચાર કરીએ અને બજેની મુશ્કેલીઓ સમજવા પ્રયત્ન કરીએ. પહેલા આપણે બુઝુગ્ગો અથવા વડીલોની દલીલ સાંભળીએ અને એનો જવાબ આપીએ.

મોટા ભાગના વડીલોની ફરિયાદ હાંય છે કે છોકરાઓ બીજી બધી એકટોવીટી કરવામાંથી જેંચા

આવતા નથી, ભણાશે કયારે? પણ આજનું Generation ઘણું જ Fast છે. વડીલાને જે શીખતાં વર્ષો લાગ્યાં હશે તે તેઓ શીખીને જન્મે છે. આજે ઘણા ઘરોમાં જોવા મળશે કે દાદા દાદીને વિડીઓ કે ટી.વી. ચાલું કરવું હશે તો પોતાના ચાર વર્ષના પોત્રને કહેશે. લાગ ફાવે તો કયું પીકચર જોવું એ સલાહ પણ એ છોકરો જ આપશે. આજના છોકરાઓનું General Knowledge ઘણું છે ભારતમાં બેઠો બેઠો એ અમેરીકાની રહેણી કરણી જાણો છે. આજે ફક્ત ભજતરનું મહત્વ નથી. ફક્ત Degree થી નોકરી નથી મળતી. એની સ્માર્ટનેસ જોવાય છે. નોકરી કરવા જાય ત્યાં કામની આવડતની સાથે બીજી activityની નાંધ પણ લેવાય છે. આજે સારું કિકેટ રમતાં કે ટેનીસ રમતાં છોકરાઓને Degree ધરાવતાં છોકરાઓ કરતાં સારી જોબ મળે છે. હા! એમને ભજતર પ્રત્યે સજાગ તો રાખવા જ જોઈએ, પણ ફક્ત ભજવાનું છે એમ તો ન જ કહી શકાય. એમની રમતોમાં એને બીજી activity માં સાથ એને પ્રોત્સાહન આપશું તો જ્યારે ભજવાનું કહીશું ત્યારે જરૂર માનશે પણ નવી પેટી ફક્ત ઊંચે અવાજે કહેવાથી માનશે નહી એમને શા માટે ના જવાબો આપવા પડશે એકવાર એમને એતું મહત્વ સમજાશે તો એ જાતે જ કરવા માંડશે આજે જ્ઞાન સાથે ગમતનો યુગ છે.

વડીલાની બીજી ફરિયાદ છોકરા છોકરીઓના કપડાં, વડીલાની મર્યાદા અને જૂના રીત-રિવાજોનું ઉલ્લંઘન છે. તેઓને છોકરાઓના લાંબા વાળ, ફીટ પેન્ટ અને બે જ્ઝા સમાઈ જાય એવા શર્ટ પ્રત્યે વાંધો છે. એમને છોકરીઓની (છોકરી કરતાં વહુઓની) મીડી પ્રત્યે વાંધો છે. છોકરાઓ પગે લાગવાને બદલે ‘હાય તેડ’ અને હાય મોમ કહે એની સામે વાંધો છે. આ

વાંધો થોડા ઘડા અંશે બાજબી છે. પણ છોકરી કે વહુને ક્રેસ પહેરવાની મનાઈ કરવાં કરતાં ચુડાદાર કે સલવાર-કમીજ ચુંબી પહેરવાનું કહી શકાય અને મીડી ન ગમતી હોય તો વડીલો સામે એ ન પહેરવા કહી શકાય. તેઓ તમારું જરૂર માનશે. આજના યુગમાં ફક્ત સાડી જ પહેરવી પડશે કહીશું તો પછી ઘણી બીજી વસ્તુઓ નહી માને. પગે લાગવાનો આશ્રા રાખીએ. એના કરતાં હલો તેડી કે હલો મમ્મી કહેતા કરી શકાય. એમાં છોકરાઓ માન નથી રાખતાં એમ વિચારનું સાવ ખોઢું છે. આજનું General માનથી હલો કહે છે અને પોતાની ઊંમરનાને હાય કહે છે. ફક્ત વિચારસરણી બદલવાની જરૂર છે. બેંગી સાડી પહેરવી એના કરતાં આખું શરીર ઢંકાય એવો ક્રેસ પહેરવો એમાં કશું ખોઢું નથી.

વડીલાની ગૈજ ફરિયાદ બીજી જાતના (મુસલમાન, પંજાબી કે ખ્રીસ્તી) મિત્રો રાખવામાં અથવા ખુલ્લ ગરીબ કે ખુલ્લ પેસાદાર મિત્રો રાખવામાં છે અને આજ પ્રકારના લગ્નો પ્રત્યે છે.

આપણા જ સમાજ સુધારકો અને નેતાઓ સર્વ ધર્મ સમાનતાની વાતો કરે છે. આપણો પણ એમાં સુર પુરાવીએ છીએ, વખત આવે ભાષણ પણ ઠોકી દઈએ છીએ. તો પછી આવી મેત્રીમાં વાંધો શું છે? આજે દરેક ધર્મમાં રૂદ્ધિયુસ્તતા હતી. તે ધીરે ધીરે ઓછી થવા માંડી છે. તેઓ દરેક ધર્મના સારા વિચારોને આવકારે છે.

ધર્મના જ રિવાજેથી તેઓ વિમુખ થતાં જાય છે. તેથી તેમને લગ્ન કરવામાં ધર્મ નડતો નથી. પરંતુ યુવાનોએ પોતાના વડીલાની ધાર્મિક લાગણી સમજવી જોઈએ, માણસ અમૃક ઊંમર પછી પોતાના વિચારો ધરમુળથી બદલી નાયે એવી આશા વહું પડતી જ કહેવાશે. ગુજરાતી ભાષી છોકરો કે છોકરીને આજના મા બાપ ધર્મના બાધ વિના સ્વીકારતાં થયા જ છે. બાકી ભાષા અને ધર્મ બન્નોના ભેદ

સાથેના લગ્નો ખાસ ટકતો નથી હતો.

ચોથી અને મુખ્ય ફરિયાદ એ છે, કે યુવાનો વધુ પડતાં ઉતાવળીયા છે. તેઓ સમજ વિચારીને આગળ નથી, વધતાં પણ યા હોમ કરી પડો ફંટે છે આગેની નિતીમાં માને છે. આ ફરિયાદ એકદમ વ્યાજભી છે. પરંતુ જમાનો જ Jet યુગનો છે. એમાં યુવાનો શું કરે? જમાનો એટલો ઝડપી છે, કે નિષ્ઠયો લેવામાં વાર લાગે તો પાછળ રહી જવાય. Sony કંપની પોતાના જ મોડેલોને બે મહિનામાં જુના કરી નાખે છે, વિજ્ઞાનમાં રોજની રોજ એક એક માન્યતા પંડિત થતી જાય છે હા યુવાનોએ વડીલોના અનુભવોને નિયોગતો લવો જ ઓઈએ અને પોતાની યોજનાઓ એમને સમજાવી એમના વિચારો દ્વારા એમા ફેરફાર કરી તેઓનો વિચાસ સંપાદન કરવો ઓઈએ. તમને શું ખબર પડે? એમ કહેવાથી તો જ્યારે નિષ્ઠળ થઈએ ત્યારે સાંભળું જ પડે 'હવે ખબર પડી બાપ કોણ છે?' બઢું ઝડપથી આગળ વધતાં, એટલાં જ ઝડપથી નીચે પડવાનો પણ ડર રહેલો છે. એટલે પોતાની મર્યાદામાં જ છલાંગાં મારવી સારી, અને છલાંગાની મર્યાદા વધારવી હોય તો વડીલોનો અનુભવ ખપમાં લવો જ પડે. વડીલોએ યુવાનોને સાહસ કરતાં રોકવા કરતાં, એમના તે સાહસમાં રહેલું ઓખમ અને પોતે ક્યાં સુધી સાથ આપી શકશે કે પડશે, તો ક્યાં સુધી પડખે રહી શકશે, એનો ખ્યાલ આપી એમના ભરોસે છોડી દેવા ઓઈએ. વાર્ષિક ન વળે તે હાર્યાં વળે.

ચાલો હવે યુવાનોની ફરિયાદ સાંભળીએ.

સૌ પ્રથમ ફરિયાદ તો વડીલો વેદિયા અને પણાત છે તેઓ ડાસ્કો અને Western music માં રસ લેતા નથી. એમને માઈકલ જેક્સન કોણ છે, કે માર્ટીના કોણ છે તે ખબર નથી એમને એ પણ ખબર નથી કે આ વર્ષે Academy એવોર્ડ કે Grammee એવોર્ડ કોને મળ્યો

આ યુવાનોને કોણ સમજાવે કે સંગીતનો પાયોજ શાસ્ત્રીય સંગીત પર રહેલો છે. પણ મના લોકો હવે આપણું અનુકરણ કરે છે. આપણી સંસ્કૃતિથી અંજાઈ જાય છે. આપણા યોગ અને નૃત્યથી પ્રભાવિત થયા છે. ડાસ્કો સંગીત અને Fast Life થી કંટાળીને શાંતિની શોધમાં યોગ ધ્યાન અને છિંદુ ધર્મ તરફ વળ્યા છે. આજે નવા યુગમાં બધું જ્ઞાનિક છે. તમને કેલક્યુલેટર વગર ચાલતું નથી અમને પલાયાં મોટે છે. તમને કેલક્યુલેટરથી ચક્કાદ્વિ વ્યાજ કાઢવામાં વાર લાગે છે અને ક્યારેક ભૂલો પણ થાય છે. એમે મોટે ગણીએ છીએ. અમને ગાંધીજી અને આપણા વિચારકોના જીવન વૃત્તાંતો મોટે છે.

જો કે આમ કહેવાથી વડીલો છટકી તો ન જ જઈ શકે જમાના પ્રમાણો તેમણે પણ છાકોરાઓ પાસેથી શીખવું જ ઓઈએ. પાંતાના વિચારો યુવાનોને સંભળાવવા હોય, કે સમજાવવા હોય, તો તેઓની સાથે કોમ્પ્યુટર કે કેલક્યુલેટર શીખવા પડશે. એમની સંગીતની સમજ કેળવવી પડશે યુવાનોએ પણ આપણા સંસ્કૃતિક વારસાને અને જીવન મુલ્યોને સાચવવા પડશે.

બીજી ફરિયાદ યુવાનોની આપણા જ રીતરિવાજો પણે છે. ઘણાં રીતરિવાજો વર્ષોથી ચાલ્યા આવતાં હોય છે. એનો અર્થ પણ ઘણીવાર ભૂલાઈ જાય છે. પણ એ રિવાજોને પાળવાની જીદ રખાય છે. હું એમ નથી કહેતો કે બધા રિવાજો ખોટાં છે. ઘણા રિવાજો ખરા છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે, પણ એમાં સમય પ્રમાણો બાંધછોડ કરવી પડે. એનો અર્થ અને શા માટે નો જવાબ આપવો પડશે. ધર્મનો આશરો લઈને નહીં પણ Logically સમજાવવા પડશે. અને યુવાનોએ પણ રિવાજોનો અનાદર કરવા કરતાં એમાં જરૂરી ફેરફાર સાથે પાળવા પડશે કારણ કે આ બધા રીવોજો એ આપણા પૂર્વજોના અનુભવોના

નિયોડ છે. ધર્મમાં આસ્થા ન રાખનાર હુનિયાના ધક્કા ખાઈને, સંજોગાથી હારીને, કટાળી ને પણ ધર્મ પત્રે પાછો ફરે છે નહી તો પછી ભૌતિક સુખોની પાછળ ભરક્યા કરે છે. ધર્મ એ સમાજનો પાયો છે. તમને ગમે તે ધર્મમાંથી, તમને ગમતાં વિચારો અનુસરો બધા ધર્મો એકબીજાથી અલગ નથી શીખવતાં તમારે જીવવા માટે કોઈક ઉપર તો શ્રદ્ધા રાખવી જ પડશે.

તો ફરિયાદમાં યુવાનો હંમેશા વડીલોને પોતાનાથી ઓછા સમજે છે. પણાને તો ધંધો કરતાં નથી આવડતું. આટલા વર્ષાથી ધંધો કરે છે, શું ભેગું કર્યું? ધંધામાં અમુક બાંધછોડ તો કરવી પડે બધું સૈદ્ધાંતો ન ચાલે.

આનો જવાબ વડીલો એક જ શબ્દમાં આપી શકે, જી તું નવેસરથી ચાલુ કર, મારા નામનો કે પેસાનો ઉપયોગ કર્યા વગર કમાઈ તો જો, કે કેટલા વીસે સો થાય છે. અમે ચોરી કર્યા વગર આટલું કમાયા પણ સુખોથી ઉંઘીએ છોએ. જે પેસા ફક્ત ભૌતિક સુખ લાવે, પણ મનની શાંતિ ઝુંટવાઈ જાય એ પેસો શું કામનો? તમે ભલે પેલાને પેસાદાર ગણીને માન આપતા હો, પણ મારી દ્રષ્ટિએ એનું સમાજમાં કોઈ સ્થાન નથી (એ વસ્તુ અલગ છે કે આજે પેસાને જ લાકો માન આપે છે).

આમ બને પેઢીની ફરિયાદો આપણે સાંભળી હવે નિષ્ઠય આપણે લેવાનો છે કે કેટલી બાંધછોડ કરવી અને પોતે બીજાના દ્રષ્ટિકોણથી વિચારી કેટલું બદલાવું. પણ નહી બદલાઈએ તો આ *Generation Gap* વધતો જ રહેવાનો અને યુવાનોએ પણ યાદ રાખવાનું છે કે તેઓ આવતી કાલે જુની પેઢી થવાના છે અને ત્યાર પછી તેઓ જ નવી પેઢી સામે ફરિયાદ કરશે. તે શું યોગ્ય ગણાશે?

#### જ નિષ્ઠલ પરીષ

## છાલો રે શામળિયો વર

મારો જાલો વર છે શ્રીશામળિયોજ  
હું તો પ્રિતે શામળિયા વરને પરણી  
જેને હાથ હોય દમામ સાહબી..... હુંતો  
ત્રિભુવન તારી, તિન ભુવનનો શ્રીનાથજી  
એહી વરની હું તો બની મહારાણીજી..... હુંતો  
સોળ સહસ્ર રાણી જેની, એની હું છું દાસી  
શામળિયા વરથી હું તો છું સોહાગી..... હુંતો  
ભવારવીના ફરે મારો સાંચો રે સંગાથી  
ભવભવનો બેરુ મારો શામળિયો ગીરીધારી  
મારો જાલો વર છે શ્રીશામળિયોજ

□ ઉધા એસ. ધારીઆ

## વહુ-દિકરી

આ લેખ વાંચી બંધ બેસતી પાછડી ન પહેરી લેશો, હસી લેજો બે ઘરી.....

સ્ત્રીના કંઈ રૂપ, દીકરી, બેન, માતા વહુ, સાસુ, નાંદ, ભોજાઈ, દેરાણી, જેઠાણી, કાકી, મામી, મારી, ફોઈ, નાની, દાદી વગરે વગરે..... આ બધાં બીરૂદ સ્ત્રીઓને મળી ચૂકે છે. જ્યારે તે યૌવના બને છે. “પરણ્યાં એટલે ઘારા લાડી ચાલો આપણો ઘરે રે...” બાર મહિનાથી તૈયારીઓ કરતાં રહી, વહુ ક્યારે ઘરે આવે એના સપના જૂઝે છે. મનમાં કંઈક ઓરતાં, અને ઉમંગ સાથે આ દિવસ આવે છે ને લગ્ન લેવાય છે. પરણ્યો વરસ બે વરસ થાય એટલે દીકરો યા દીકરીના દર્શન થાય પણ જ્યારે દીકરો આબ્યો હોય એ પચ્ચીસીએ પહોંચે એટલે વહુ લાવવાના કોડ પૂરા થાય છે, અને વહુમાંથી માતા, અને હવે સાસુ બને છે. જેમ કે “સાસ ભી કભી બહુથી.” જ્યારે આવનારી કુંવારી કન્યા પરણ્યો એટલે નવવધુ બને છે. અને એક વાત જરૂર કહીશ, કે સ્ત્રીનું હૈયું કોમળ, દયાળું, અને મમતા ભર્યું હોય છે; અને આ વાત એટલી જ વિદીત છે. બચેના હંદયમાં, સાસુ અને વહુના હંદયમાં અરમાનો ભરેલાં જ હોય છે. કોડભરી કન્યાના હંદયમાં પણ અનેક કોડ રમતાં જ હોય છે. તેને સંસારના અંતરંગ જોવા અનુભવ્યાં નથી હોતાં, અને મનમાં અનેક સપનાની જાળ ગૂંથી કાઢે છે. વળી ઉપર સ્ત્રીના ગુણમાં એક અવગુણ એટલે કે સ્ત્રી જ સ્ત્રીની ઈર્ષા સીધી યા આડકતરી રીતી એ કરતી જોવા મળે છે, અને ગભરું બાળકી જે આજે સાસરામાં કંકુપગલાં પાડતી આવી છે, એની કાન ભંભેરણી શરૂ થાય છે. સાસરે મોકલ્યા પછી માઓ

તરફથી ખેચતાણ ચાલુ થાય છે. બપોરના સમયે સાસરેથી પીએર આવેને છોકરીઓને કામનું ચિંધણું થઈ જાય છે. “મારું આ મેચિંગ બ્લાઉસ લાવી આપજેને? જરા આટલું બીલ પે કરી આવજેને? ચાલ તું આજે વહેલી આવી છે તો આપણો મામીને ત્યાં બોરીવલી જઈ આવીએ?”

આમ સાસરેથી આવેલી દીકરીને સારો મજાનો ગરમાગરમ નાસ્તો ખવડાવીએ, વાત વાતમાં શીખામણ દઈએ કે બેન, તું બે ઘરની દીવડી બનજે. તારા પણાનું નામ ઉજાળજે. પણ આથી કંઈક ઉલટી જ વાત બને છે. પોતે પણ દેરીયા જેઠીયાની ઈર્ષાને એવી વજુદ વિનાની વાતો કરે કે દીકરીઓ પણ કંઈક આવું જ વિચારતી થઈ જાય છે. હું શું કામ એકલી....? બજેનો સરખો જ હક્ક હોય છે. પહેલાં તો જેઠ એટલે તેની પણ માન મર્યાદા રહેતી, આમાન્યા રહેતી, અને આજે તો એ મોટો શેનો? બધાં જ સરખાં?

અને જ્યારે પિયેરીયાની ખેચતાણ વધે કે સાસુને ગમતુ જ ન આવે, સાસુના મનમાં ખોટ આવે છે, જો હા, તેટાડ જરૂર વહુ વહા છે. આપડાં વ્યક્તિ એ આપણા ઘરની લક્ષ્મી છે એની ઉપર બીજા જાગ્રા જરૂર દોયાવે કે કાલ વરસાવે તો તે વ્યક્તિ એ ઘર વચ્ચે વેંચાતી જાય છે. જ્યાનું મન ડામા ડોળ થાય છે. માને સાસુ વચ્ચે તોલાતી રહે છે. જેમ એક રમકડું બાળક રમતું હોય તે જો બીજા સાથે શેર થાય એ બાળકને ગમતું જ નથી હોતું એવું જ વહુના પ્રેમમાં કોઈ ભાગી થાય એ સાસુને ગમતું નથી આવતું. હા, જરૂરીયાત હોય, માંદે સાજે તમે એક નહી દીકરીને બે કામ સૌંપો એની ના નહી. પરંતુ દીકરીઓ બાવિસ, ત્રેવિસ વર્ષે પરણ્યી હોય અને મા, મા કરતી રહે એ ખોટું છે. માને ભૂલવાની નથી હોતી પણ સાસુમાં માની મૂરતાનું નિરૂપણ કરવું જ જોઈએ. જૂના જમાનામાં નાની ઉમરે દીકરીઓ પરણ્યાતી એટલે અને

વળી ગામમાં બીજે જવાનું પણ ક્યાં હતુ, ન નાટક, ન રેડિયો, કારણ વીજળી જ ન હતી, અને તેથી તેઓ માને ત્યાં જઈને બેસ્તીને, સાસુઓ મંહિર દેવ દર્શન જતી, વળી સાંજની રસોઈમાં રોટલા, ભાખરી, દૂધ, શાક કે અથાણુ. આમ તે જમાનાને તે અનુરૂપ હતુ પિયરે જવાનું, પણ આગળ કહ્યું તેમ “વીસે વહાણ” પછી રોજ પિયેરની ખેંચતાણ સારી નહી. આઈ દિવસે એકાદવાર મમ્મીના ઘરે જ જવું જોઈએ. ઘણાંની દલીલ એવી કે બિચારી નાની છે ત્યાં સુધી જશે પછી તે ઘરની જંજળ બાળકોની વગળશે પછી ક્યાં જવાની છે? વળી ઘણો ઠેકાણો એવું પણ હોય છે કે વહુ પિયેર જાય એટલે સાસુઓ એની રીતે મોકળાશ અનુભવે છે. આમા સમજ એટલી જ લેવાની કે દરેક જણાને જેમ કરવું હોય એમ કરે એ સાચું છે પણ પછી વહુઓને ઘરમાં જીવ લાગતો જ નથી, પિયેર જાય બહેનપણીઓ મળે, ઝોન પર બેસે અને કામથી છૂટકારો મળે, આદતથી મજબૂર તેને પછી ઘરમાં ઓછું ગોઠે છે, અને કામથી દૂર ભાગે છે, અને વળી સાસરામાં બેસે તો લાંબી સોડ કરીને સૂઈ જતી હોય છે. અને હા તેમના બાળકો હોય તો, દાદી જે હોલમાં સૂતા હોય તેમને તંગ કરતા રહે છે. “બા પાણી આપો, બા આ છોલી આપો, કોઈ ટેલીફોન આવે, વળી કોઈ ડોરબેલ વાગે, તો બાળકો નાસ્તો માંગો, આમ વહુઓ પોતાના બેડરમણમાં પડદો કરી બારણું આડું કરી સૂઈ જાય અને સાસુઓ પીલાતી રહે છે. ઘણી ઘણી સાસુઓ વહુઓથી ઉરતી રહે છે. કેમ કે બહાર કઈ વાત કરશો તો? અને વળી ઘણો આનાથી ઉલટું પણ હોય છે. વહુઓને પારકી ગણો છે. પોતાની દીકરીઓની સાથે કાનાફૂસી થતી રહે છે. ટીક છે આ સંસાર છે, કઈ વાતે સાસુ, મા, કેવહુ જવાબદાર હોય છે. પણ સંસાર આગળ જતાં અસાર ન થાય એની તકેદારી રાખવી જરૂરી છે અને ખરેખર અસ્ત્યારે ઘણા ઘરોમાં આ સમસ્યા બની ગઈ હોય છે. ઘણો તો છૂટાછેડા, ડીવોર્સ.

જો વહુઓ આઈ દિવસે એકાદ બે વાર પિયર જાય અને વચ્ચેના સમયમાં તમે તમારા ઘરને ઘર સમજી, પોતાનું ઘર સમજી, સજાવો, સંવારો, નિત નવું બનાવી ખવડાવો, સાસુ સાથે કહે ત્યારે બહાર જાવ. સાસુને જેટલી રીતેએ બને એટલી રીતીએ હેલ્પફુલ થાવ. રાતના જ્યારે પોતાના વરજી, પિયુણ્ણ આવે ત્યારે સજી સંવરી ફરવા જાવ અથવા આનંદીત થઈ અલકમલકની ગણ્ણા ગોછિ કરો આમાં કોઈ ફિસ્ટિયાદને અવકાશ જ ન જોઈએ. સાસુ કે સસરા બહારથી આવે જે વરજી, તેમને હાથમાં પાણીનો ગલાસ આપો, હાથમાંથી બેગ, થેલી લઈ લો, સાસુના હર કામમાં, યા વરના, યા સસરા, દિયેર, જેઠના હર કામમાં મદદગાર થવાની ભાવના કેળવો. યંગ છો તો કંટાળાને નેવે મૂકીને આગળ વધો, કદાચિત ભણતરનો પણ બે પેઢી વચ્ચે ફરક પડે, પણ તમારા ભણતરને સંસ્કારને દીપાવતી દીવડી બનો. બધાં જ ખુશ, સૌના મન જીતી લેશો એટલી તમારી લાઇફ સરળ બનશે. હા થોડી સહનશક્તિ કેળવવી જરૂરી જ છે. માતા પિતાની જગાએ તમારી સાસુ સસરાની છબી નિહાળી કામ કરશો, એજ સૂખી ફુટુંબની ચાવી છે. મોટી ઊમરના સાસુ સસરાની સેવા જે રીતે થઈ શકે તે રીતે દફ-મનોબળ કેળવીને કરો. તેમની દવાઓ કાઢી આપો, તેમને જોઈતી ચીજ વસ્તુ યા પાણી બેઠા બેઠા આપો, સેવાની સામગ્રીમાં મદદ કરો, પિયેરને થોડું ભૂલી ઘરને સ્વર્ગ બનાવો.

હવે આ વાતની સામે દલીલ એવી થાય છે કે અમે કાઈ દીકરીને વેંચી નથી દીધી? એનું મન હળવું થાય? ગમે તેમ સાસરું છે? દિલની વાતો તો માને જ કહેને? રોજ ઝોન પર મળતી દીકરીઓને દર એકાંતરે પિયેર ન બોલાવો કે ન રહેવા બોલાવો, દર મહીને? સાસરે તો લીલા લહેર જ હોય કે ન પણ હોય, એ જ આપણું મંગલ ભવન, મંગલમય જીવન છે એવું મનમાં ઠસાવી દેવું જ જોઈએ. જો જે ઘરમાં સાસુને મા ન

ગણતા જ્યારે પિયેરને ઘારું ગડો છે એ જ ઘરમાં સાસુ વહુના ઝઘડાને સ્થાન મળે છે. જુદા રહેતાં થાય છે. અને બીજી એક વાત વહુઓ વરોને પોતાની બાજુ દૂમ હિલાવતાં કરી મૂકે છે, કે વરો એટલે કે છોકરાઓ પણ ઘાઘરીના સગામાં અને બૈરીનાં આંખના ડોળામાં માબાપને ભૂલી જાય છે. બૈરી મારી પરમેશ્વર થઈ જાય છે, અને એટલે જ સાસુ વહુની ખેચતાડા ભરી જુંદગી થઈ જાય છે. ક્યારેક તો માબાપને ભૂલી સાસુ સસરાની કદમબોસી કરતાં થઈ જાય છે પેટના દીકરાઓ જ્યારે આવા નિર્દ્ય બને ત્યારે માતાપિતાની આંતરડી કકળે છે. અને મુંગી હોય તમારા જીવનને વિશારી બનાવે એ હકીકત છે. માતા પિતાનો સ્વભાવ કદાચિત લડાકુ હોય તો પણ દીકરાઓએ શાંત પડો બશે આંખે માતાપિતા અને બૈરીને જોતાં શીખવું જોઈએ. વહુએ દૂધમાં સાકર ભળે તેવી જ રીતે તમે સાસરામાં ભળી પોતાનું સ્વગૃહ ગણી, તેની દિવાલો, પડોશીઓ સર્વને તમારા જીવનમાં સ્થાપિત કરો. દૂધમાં સાકર ભળે પછી કોઈની તાકાત નથી કે સાકર દૂધ જુદા કરી શકે. હર કોઈ મોટા કામ કે સફાઈ કામ કે નાસ્તાનું હોય કે શોપિંગનું હોય, કે ઘરનાં ભાજ્યાલા લાવવાનું કામ, સર્વ કામ નાનું ન ગણતાં કામ કામ જ છે, અપનાવીને મદદગાર થાવ. ગામ હોય ત્યાં ડેડવાડો હોય જ. લોકો ગમે તેમ બોલશે, ચડાવશે માટે ઘર તમારું જ છે. કામથી સાસુઓ પણ હર હંમેશા ખુશ રહેશે. સાસુઓ પણ તમારા આ પ્રેમથી એટલાં પ્રભાવિત થશે કે તમે જે કહો તેમાં હાં મિલાવશે.

સાસુ, વહુ, મા આ ગ્રણાના ત્રિકોણ જેમ લાલ ત્રિકોણ ઊજરસ છે તેમ આ પણ ભયજનક જ છે. માને ત્યાં વીસ વર્ષ વિતાવ્યાં છે હવે અહીંયા એવા પ્રેમ સહ વીસ વર્ષ વિતાવીએ તો દુનિયા જાણે કે દીકરી બે ઘરની દીવડી બની પ્રકાશ ફેલાવી માબાપના નામને ઉજાળી રહી છે.

હવે સાસુઓએ પણ સમજવા જેવી એક વાત કે વહુની વાતમાં રસ લે, વહુ તેની નાનપણાની, બહેનપણાની, સ્કુલની કે પછી તેના માતાપિતાની વાતો રસભરી રીતે કહે તો તેમાં તમે પણ રસ લો. વહુનું મન વાંચી લેતાં શીખો. તેના પિયેરીયાને માન આપો, તેના પિયેરીયાને જમવા બોલાવો, તે તેને બહુ જ ગમતું આવશે. પિયરે અને પિયેરની વાટ ભૂલી તમારા ઘરમાં તે આવી છે તો તેને માની મમતા આપો. લોકોની માન્યતા છે કે સાસુ કદી મા ના બની શકે આ કથનને જૂઠલાવી દો. તેની કોઈ ભૂલ હોય તો તે જ્યારે શાંતિથી બેઠી હોય ત્યારે પ્રેમથી સમજવી દો કે તારી અહીંયા ભૂલ થાય છે. આ ખોટુ થાય છે, વગેરે વગેરે.

આજકાલ તો છૂટા છેડા, ડીવોર્સ શબ્દ બહુ જ સસ્તાં તોળાય છે. પરંતુ બંધના પાણી છલકાય એ પહેલાં પાળ બાંધો, ઘરને જ્યાંથી ભડકો દેખાય ત્યાં જ ઢારી દો. દરેકના મન માનસને વાંચી ઘરના મોભી બની શાંતપણો, કલ્યાણકારી રીતી એ મમતાને તોળીને ઘરને સ્વર્ગ બનાવી લો, ફરી એકવાર કહીશ કે આ લેખ જનરલ જ લખ્યો છે, કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરશો હા, એકવાત જરૂરથી કહીશ કે આમાંની કોઈ વાત તમારા ઘરને ચિંગારી બની બાળતી હોય કે દીકરીનું ઘર બાળતી હોય તો તમારી દિશા બદલી કાઢજો. દીકરી અને મા, સાસુ અને વહુ એક જ મુખવટો છે. પહેલાં મા દિકરીનો હતો, હવે બદલાઈને સાસુવહુનો એક મુખવટો બની ગયો છે. સાસુ માનો મુખવટો પહેરે, વહુ-દિકરીનો મુખવટે પહેરે આમ અદલ બદલ તો થાય છે. પર ઘરની દીકરી એના સ્વજનોને છોડી આપડા ઘરમાં સમાય, દૂધ સાકર એક થાય એવી રીતે મમતામથી માનું નિરૂપણ સાસુમાં થાય અને એજ દીકરીમાં વહુનું “સાસભી કભી બહુ થી.” મા બાપની કરેલી સેવા ક્યારેય અફણ નથી જતી. આજમાયશ કરી જોજો.

□ ઉધા એસ. ધારીયા

## આપણા સામાજિક રીત રીવાજો

આપણા વડીલો વર્ષો પહેલાં ગામમાં જ રહેતા હતા, ગામ અને આજુભાજુ વાડાસિનોર તાલુકાનાં ગામડાંના લોકો સાથે વ્યાપારી લેવડ દેવડ થતી. આ સિવાય ગામ બહાર જવલ્લેજ નીકળવાનું બનતું. ત્યારે તે સમયે લગભગ બધાજ જ્ઞાતિજનો એકમેકની નજીફ, આજુભાજુમાં વસતા તેથી સામાજિક અનેક પ્રસંગો હાજરી પુરાવી પ્રસંગોચિત લાગણીઓ વ્યક્ત કરી વ્યવહાર સાચવતા, સમાજના કેટલાક રિવાજોમાંથી મૃત્યુબાદની કીયાપાણી, વિધિની પડેલી/પાડેલી પ્રથાઓનો હું ઉલ્લેખ કરીશ. જેનો જન્મ થયો તેનું મૃત્યુ નિશ્ચિત છે. માત્ર સમયનો સવાલ છે. જ્યારે કોઈ કુટુંબમાં સ્વજનનું મૃત્યુ થતું ત્યારે સ્મરણ યાત્રામાં જતા તે પછી આઈ દિવસ સુધીના બેસણામાં જતા. નવમાંનું ઉઠમણું થતું તેમાં જતા. પછી દશ થી તેરમાં સુધીની ઉત્તરક્રિયા-વિધિ થતી તેમાં પણ અચુક હાજરી પૂરાવતા. આ બધું જ કરતા કારણ આપણો એકમેકની આજુભાજુમાં રહેતા. સમયપણા ઈતર પ્રવૃત્તિઓના અભાવે ફાજલ રહેતો. તેથી જ આમ કરવું સરળ અને અનુકૂળ હતું પરંતુ આજે સમય સંજોગો બદલાઈ ગયા છે. જ્યારે મોટોભાગના સગાંસંબંધીઓ વી.પી. રોડ, ગીરગામ, સેન્ડહર્સ્ટ રોડની આસપાસમાં જ રહેતા ત્યારે પણ અગાઉ લખ્યા મુજબ મૃત્યુબાદની કીયાપાણી-સરવાણી-બેસણું-ઉઠમણું વિગેરે વિધિમાં અનુકૂળતા મુજબ હાજરી પૂરાવતા. સમયના વહેવા સાથે આપણા લોકો દૂર દૂર કોલાબાધી વિરાર-થાણા સુધી રહેવા જવા લાગ્યા. વેપાર રોજગારમાં જોડાયા, સાથે સાથે ઈતર સામાજિક પ્રવૃત્તિઓ આદરી. આમ બધા જ શહેરીજીવનમાં બહુ જ ઉધ્યમી થઈ ગયા. રહેવાનું દૂર દૂર અને સમયની સાઠમારીને કારણે આપણો થાકીને મૃત્યુબાદની કીયાપાણીની પ્રથામાં આપોઆપ

સુધારા લાવવા મંડાયા નવમાને બદલે પાંચમાનું ઉઠમણું, સમાજના મોટા પ્રમાણમાં સગાંસંબંધીઓને સાંકળતી બારમા-તેરમાની લૌકિક પ્રથા વિગેરે વિધિઓ થતી રહે છે. અને મોટોભાગના સમાજના લોકોને હાજરી પુરાવવી પડે છે. મને લાગે છે કે મૃત્યુ એ દરેક કુટુંબનો અંગત હું: બદ પ્રસંગ સમજી સમાજના લોકોને સાંકળ્યા વગર પોતાના સંતોષ માટે કરે તેમાં મારે કંઈ કહેવાનું રહેતું નથી. કારણ કે આ વિધિઓ સમાજના મોટોભાગના સગાં-સંબંધીઓને સાંકળશે નહિ. કહેવાનું તાત્પર્ય એ છે કે બદલાએલા સંજોગો અને પરિવર્તન પામેલી જીવનશૈલી નાકારણો આ બધી વિધિઓમાં હાજર રહેવાનું પ્રતિકૂળ લાગવા માંડયું છે. એટલે મૃત્યુબાદની આ વિધિઓને-પ્રથાઓને આપણો બદલવી જ પડશે કુટુંબીજનો પ્રત્યે માત્ર મરણના દિવસે જઈ લાગણી પ્રદર્શન કરીએ તે બરાબર છે. બેસણામાં આપણો જઈએ છીએ ત્યારે મોટા ભાગના લોકો વાતો જ કરતા હોય છે તો કેવળ પ્રથાને કારણો દેખાડ કરવા બેસણા-ઉઠમણા વિગેરે વિધિઓમાં જતા રહીએ તેનો કંઈ અર્થ ખરો? આપણો આ વિષે શાંત ચિંતે વિચારીએ. મૃત્યુના દિવસે જ હાજર થઈ જે કુટુંબ છે જેને હું: બનું આવી પડ્યું હોય તેઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરી તેમનું હું: બ હળવું કરી શકાય. કહ્યું છે ને કે હું: બનું ઓસડ દહાડા તેમ બીજા દિવસથી હું: બ હળવું થતાં અંગત કુટુંબીજનોની હાજરીથી જ તે ભૂલાતું જશે. આ રીતની પ્રથાઓથી તે કુટુંબના હું: બમાં કંઈજ ફરક પડવાનો નથી. માટે આવી પ્રથાઓ સમાજના મોટોભાગના લોકોએ પાળવા-પોખવાની આવશ્યકતા જણાતી નથી. મૃત્યુબાદના બેસણા-ઉઠમણા તથા બારમા તેરમાની પ્રથા બદલાએલા સંજોગો પ્રમાણો બંધ કરવી જોઈએ. આ કીયાઓથી મરનારને કંઈજ ફરક પડતો નથી. હા! પાછળ રહી ગયેલા કુટુંબીજનો પોતાની ઈચ્છાઓ પુરી કર્યાનો સંતોષ લઈ શકશે કે અમે આમ કર્યું. બાકી એમ માનતા હોઈએ કે મરનારના આત્માને શાંતિ મળે

## શ્રી બાલાસ્થિનોર નવયુવક સંઘ

એ માટે કર્યું તે બરાબર નથી લાગતું મરનારના આત્માને શાંતિ તો તેના કર્માના આધારે જ ભળી જતી હોય છે આવી પ્રથાઓ પાળવાથી શાંતિ આપી શકાતી નથી. આ બધું આપણે આપણા પોતાના સંતોષમાટે કરીએ છીએ, મરનારનો જીવનદીપ બુજાઈ ગયા પછી પાછળ કશું જોવાનું રહેતું નથી. માટે ફરી ફરી લખું છું કે સમાજને સાંકળતું બેસણું ઉઠમણું (ઉઠમણામાં દૂર સુદીરથી બે-ત્રણ કલાક બગાડી પાંચથી દશ મિનિટ મોહું બતાવવા-દેખાવ કરવા આવવું પડે છે) બારમાતેરમાની વિધિ બંધ કરવી જોઈએ. આ વિધિઓ સામાજિક રીત-રીવાજ બની રહી છે એટલે લોકોને તેની પાછળ જોયાઈને મને-કમને જવું પડે છે. આ મારા વ્યક્તિગત વિચારો છે. બાકી કોઈ ફુટુંબે અંગત રીતે પોતાના ફુટુંબ પુરતીજ આવી કિયાઓ કરવી જ હો. તો તેમ કરીનો તે ઓ પોતે સંતોષ મેળવે તેમાં

સામાજિક રીતે કંઈ કહેવાનું હોય નહીં. તે પોતાનો અંગત પ્રસંગ બનાવી પોતાની રીતે કંઈપણ કરે જેમાં સમાજને ખેચવાનું હોય નહીં.

આગાઉ જ્યોતિ-પુંજના અંકમા 'પ્રસાદ'ના ઉપનામથી બેસણા ઉઠપણા માટે વિચારો બ્યક્ત થયા હતા તેથી મને વિચાર આવ્યો કે ચાલ હું પણ મારા સ્પષ્ટ-મક્કબ વિચારો આ પત્ર દ્વારા જ્યોતિપુંજના વાચકો સમક્ષ મૂકું આ મારા વ્યક્તિગત વિચારો છે. સમાજને કોઈ સલાહ આપવાનો ઈરાદો નથી. વિચારો ગમે તો અપનાવવા નહીં તો ધ્યાનમાં ન લેવા. મનમાંથી કાઢી નાખવા પણ અંતમાં ફરી એકવાર મક્કમપણે કહીશ કે બદલાએલા સંજોગો અને પરિવર્તન પામેલી જીવન શૈલી જોતાં આમ કર્યા વિના આપણે રહી શકીશું નહીં. છેવટે થાકીને પણ ફેરફાર કરી નાખીશું.

ક રસીક પરીઅ

# અભલીને અમેરીકા જુદુ છે

(નતાંકથી ચાલુ)

થોડા દિવસ પસાર કર્યા બાદ બબલીનું મગજ ફરીથી ચસક્યુ. આજે બબલો ધરે આવે ત્યારે તેની વાત છે. એ શું મને મૂરખ બનાવે છે. હું વિચાર કરીશ એમ કરીને કેટલાંક દિવસ પસાર થઈ ગયા પરંતુ તે અમેરિકા જવાનું કઈ નામ લેતો નથી. મગજમાં આમ વિચારો ભરાતા હતા. હું તને આજે બતાવવા માગુ છું કે તુ મને ભુલાવવા માગતો હોય તો એ હું ભુલીશ નહીં. આમ મગજમાં જુદા-જુદા વિચાર કરી મન મક્કમ કરી આજે બબલો આવે ત્યારે ચોક્કસ કહી નાખું.

બબલો સાંજે ઓઝીસથી તેના રોજના નિયમ મુજબ ધરે આવ્યો ત્યારે બબલીનો ચહેરો ગંભીર હતો.

બબલાએ પુછ્યું આજે કેમ કંઈ થયુ છે? તુ આજે ગંભીર છે.

બબલીએ કહ્યું શું તમે મને મૂરખ સમજો છો કે પછી મારી કોઈ ગણાના નથી તમે તમારા મગજમાં શુસમજો છે?

બબલાએ કહ્યું કંઈ સમજાય તેવી વાત કર

બબલીએ કહ્યું કેટલાક દિવસ પહેલાં એમેરીકા જવાની વાત થઈ હતી અને તમે કહ્યું વિચાર કરીશ. મે આટલા દિવસ તમારા વિચારની રાહ જોઈ હું શાંત બેઠી એટલે તમે એમ સમજ્યા કે હું ભુલી ગઈ હોય તો એ તમારી ભુલ છે. હા, હવે બોલો શુ વિચાર કર્યો?

બબલાએ કહ્યું. હજુ હું ધરમાં હમણાં આવ્યો છું. જરા શાંતિથી બેસવા દે, ખા પીવા આપ પાણી આપ પછી આપણો વાત કરીશું બબલાએ ચા-પાણી પીને વાત કરવાનું કહ્યું એટલે બબલી જરા ઠંડી પડી.

બબલાએ કહ્યું મે તાનો કહ્યું હતુ કે તારી

બહેનપણીઓને પુછી જો જે કે ત્યાં સ્થાઈ કેવી રીતે થવાય તો તે પૂછ્યું?

બબલીએ કહ્યું, મે મારી બહેનપણીઓને ફોન પર વાત કરી પુછ્યું તેઓ કહે છે કે ફરવાના વિઝા પર આવવાનું અને વસવાટ શરૂ કરવાનો, પડશે એવા દેવાશે એમ વિચારવાનું.

બબલાએ કહ્યું હું આ રીતે ગેરકાઈદેશર જવામાં માનતો નથી. ત્યાં જઈને પકડાઈ જઈએ તો શું થાય.

બબલીએ કહ્યું તમે જ્યારે કાંઈ વાત નીકળે એટલે પહેલાં નેગેટીવ ભણો છો, ક્યારેક પોઝિટિવ વિચારો.

બબલાએ કહ્યું, જંદગીમાં દરેક વખતે સારુ અને ખરાબ બન્ને પરીણામ વિષે હંમેશા વિચારવું જોઈએ. જો એમ ન વિચારીએ તો જંદગીમાં બીજા અનેક નવા પ્રશ્નો ઉભા થાય.

બબલીએ કહ્યું વીજીટર વિઝા પર જઈએ અને ત્યાં સ્થાઈ થઈએ તેમાં તમને વાંધો શું છે? મારી બાની બાજુમાં રહેતા કાકાના પુત્ર વિઝીટર વિઝા પર બાર મહીનાથી ત્યાં ગયા છે ત્યાં તેમને કોઈ વાંધો આવ્યો નથી તો આપણાને વાંધો આવશે. તમે તા નિષ્ઠા છો ક્યારે હિંમત કરો હિંમત કરીશુ તો આગળ આવીશું.

બબલાએ કહ્યું, તે ધરજ સંભાળ્યું છે બહેનપણી હુન્નાના બનાવો અંગે વિચાર્યુજ નથી. ગેરકાઈદેશર ત્યાં જાવ એટલે ત્યાં કાયદેશર નોકરી મળે નહિ ગેર કાયદેશર નોકરી કરવી પડે. આ કામ આપણા દેશના લોક જ આપી શકે. હાલમાં ત્યા ચાલીસ કલાકની નોકરી જે લોકો કાયદેશર રહે છે તેમને કરવી પડે અને તે પણ અઠવાડિયાના પાંચ દિવસ મર્યાદિત હોય છે અને આવી નોકરી કરવાવાળાઓને ત્યાના નિયમ મુજબ પગાર મળતો હોય છે ત્યાં પગાર મીનીમન કલાક પર હોય છે જ્યારે ગેરકાયદેશર નોકરી કરવાવાળા અઠવાડિયાના સાત દિવસ કામ કરે છે અને તે પણ રોજના દસથી બાર કલાક કામ કરે છે કારણ કે તેઓનું ધ્યેય પૈસા કમાવવાનું હોય છે. ગેરકાયદેશર કામ

કરવાવાળા નાની દુકાનમાં, ખાવા પીવાની હોટલમાં અથવા મોટેલમાં કામ કરતા હોય છે. અહી જે કામ આપણા નોકરો કરતા હોય છે તેવું કામ ત્યાં આવી ગયેલા માણસોને કરવું પડે છે.

હોટલનું કામ એટલે ઓર્ડર પ્રમાણે નાસ્તો ચહા વગેરે આપવું તેમ ડીશો ખાધા પછી ઉઠાવવી જેવું કામ કરવું પડે છે. મોટલ એટલે ફક્ત રહેવાની જગ્યા કહેવાય. જે લોકો આવા કાર્ય કરવા સંપૂર્ણ તૈયારી સાથે જાય તેઓજ આવા કાર્ય કરી શકે.

બબલાએ કહું ઘણા લોકો ગેરકાયદેશર જાય છે તેઓ આવુ કામ કરતા હશે?

બબલાએ કહું હા, આવુ જ કામ કરવું પડે, ત્યાં જવા માટે કાયદેસર જવું તે યાગ્ય રહ્સ્તો છે. ઘણા લોકો ટૂરીસ્ટ વીસા લઈ ત્યાં કાયમી વસવાટ કરે છે અને કાયદેશીર થવાના રસ્તા વિચારે છે. જેવા કે ટૂરીસ્ટ વીસા પર ગયેલા કુંવારા છોકરા-છોકરી ત્યાં કાયમી રહેતા હોય તેની સાથે લગ્ન કરી કાયમી થઈ જાય છે. તારી બાની બાજુવાળાના પુત્ર અને તેની પત્ની ટૂરીસ્ટ વીસા પર ગયા અને ત્યાં રહી ગયા તે કાયદેશર ક્યારે અને કેવી રીતે થશે એ તો તેઓજ જાણો?

બબલાએ આગળ જડાવ્યુ કે આપણા દેશમા ગેરકાયદેસર માણસો મોકલવાનો ધંધો ચાલે છે. આ ધંધો કરવાવાળા આઠ થી દસ લાખ રૂપીયા લે છે એમાં અહીં પચીસ ટકા આપવાના હોય છે અને બાકીની રકમ ત્યાં પહોંચા પછી બે વર્ષમાં પૂરી કરવાની હોય છે. આવા જવાવાળાઓ કેટલાક તકલીફ ભોગવી ગ્રાન્ચાયાર મહીને ત્યાં પહોંચે છે. આ ધંધો કરવાવાળાની એવી શરત હોય છે કે તમને અમેરીકાની અમુક બોર્ડર પર ઉતારશે ત્યાંથી તમારે તમારી સગવડ કરવાની હોય છે. એ માટે દરેક જનારને તેઓ પચીસ ડૉલર રોકડા આપે છે જેથી તેઓને જ્યાં ઉતારે ત્યાંથી તમારે તમારી સગવડ કરવાની હોય છે.

હાલમાં હવે ત્યાં લોકો કાર્યક્રમ આપવા જાય છે તેમનું એક ચુપ હોય છે. આ ચુપ બનાવવામાં તેમના ચુપમાં બે-ચાર જણાને આઈ-દસ લાખ રૂપિયા લઈને લઈ જાય છે. ત્યાં ગયા પછી તેઓ ચુપમાંથી છુટા પડી પોતાના સગાવાળા તથા ઓળખીતાને ત્યાં પહોંચી જાય છે પછી તેઓ ગેરકાયદેસર રીતે કામ કરી તેમનું કાર્ય શરૂ કરે છે. આજે લોકોને અમેરીકા જવાનો બહુજ મોહ થયો છે અને યેનકેન પ્રકારે કેમ જવું એમ વિચારે છે.

એમના ભાઈ-બહેન ત્યાં રહેતા હોય અને તેમને અહીં રહેતા તેમના ભાંડુ માટે થ્રીન કાર્ડ એટલે કાયમી વસવાટ માટે અરજી કરી હોય તો તેવા કેસમાં બારથી વધારે વર્ષો વતી જાય છે માટે તે રીતે જવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે. કારણ કે જ્યારે તમારી અરજી પાસ થાય ત્યારે તમારા બાળકો એકવીસ વર્ષથી નાના હોય તો તમે સાથે લઈ જઈ શકો છો. જ્યારે તમારા ભાંડુઓએ અરજી કરી હોય ત્યારે તેમને એમ કે ભાઈ-બહેન કે તેમના બાળકો સાથે આવશે અને અહીં સુખેથી રહી શકશે. પરંતુ આવા લાંબા વખત પછી છોકરાઓ મોટા થઈ જાય છે અને છોકરાઓ પરણી પણ જાય છે આવા કેસમાં જેના માટે અરજી કરી હોય તે રહી જાય છે જ્યારે ભાઈ-બહેન જેના માટે અરજી કરી હોય તેઓને એકલા જવું પડે છે.

બબલાએ આખરે કહું આપણે કાયમી જવા માટે વિચાર માંડીવાળ પણ આપણે અમેરીકા જોવા જવું. ત્યાં જોયા પછી આપણે આગળ વિચાર કરશું. આ આપણે અહીં તર્કવિતક કરવાથી કંઈ થવાનું નથી. માટે જો તુ સંભત થતી હોય તો આપણે ફરવા જવાનો પહેલો વિચાર કરીએ. ત્યાં ગયા પછી ત્યાંની છંદગી તુ જો અને તને કેમ લાગે છે? પછી આપણે કોઈ નિર્ણય પર આવીશું. રાત ઘણી થઈ ગઈ છે અને મને સખત ભુખ લાગી છે તો ખાવાની તૈયારી કર.

□ જ્યાંતિલાલ કડકીયા

**SHREE BALASINOR NAVYUVAK SANGH  
JANSATHI TROPHY CRICKET TEAM FOR THE YEAR 2003-04**

**GROUP 'A'**

**NAME OF THE GROUP**

Praful Natverlal Dharia

**TEAM - A1**

**No. Name of The Player**

|     |                   |           |
|-----|-------------------|-----------|
| 1.  | Nihar A. Kadakia  | (Cap.)    |
| 2.  | Rupesh K. Modi    | (V. Cap.) |
| 3.  | Ripal B. Parikh   | (W.K)     |
| 4.  | Sandip K. Dharia  |           |
| 5.  | Amish U. Desai    |           |
| 6.  | Yomesh N. Shah    |           |
| 7.  | Sanket N. Modi    |           |
| 8.  | Nilesh C. Kadakia |           |
| 9.  | Gopal R. Sheth    |           |
| 10. | Tushar S. Parikh  |           |
| 11. | Nitin R. Gandhi   |           |
| 12. | Ripal H. Desai    |           |
| 13. | Arpit Dharia      |           |
| 14. | Deval A. Mehta    |           |

**TEAM - A2**

**No. Name of Player**

|     |                     |            |
|-----|---------------------|------------|
| 1.  | Dipen K Modi        | (Cap.)     |
| 2.  | Vaishalya N. Gandhi | (Wk.V.Cap) |
| 3.  | Mitul B Parikh      |            |
| 4.  | Sramik J. Shah      |            |
| 5.  | Bhavik A Parikh     |            |
| 6.  | Hitesh N. Shah      |            |
| 7.  | Rakesh N. Dharia    |            |
| 8.  | Shailesh O Parikh   |            |
| 9.  | Nitin J Parikh      |            |
| 10. | Asish V. Shah       |            |
| 11. | Nevil Kapadia       |            |
| 12. | Gaurang Kacheria    |            |
| 13. | Yatin Desai         |            |
| 14. | Jigar S. Shah       |            |

**TEAM - A3**

**No. Name of Player**

|     |                  |           |
|-----|------------------|-----------|
| 1.  | Kinjal P. Parikh | (Cap, Wk) |
| 2.  | Rikit N. Modi    | (V.Cap)   |
| 3.  | Dharav R. Parikh |           |
| 4.  | Suketu N. Parikh |           |
| 5.  | Nimish B. Parikh |           |
| 6.  | Rupin P. kadakia |           |
| 7.  | Tushar N. Dharia |           |
| 8.  | Anish Doshi      |           |
| 9.  | Kunal T. Dharia  |           |
| 10. | Ashok J. Dharia  |           |
| 11. | Nilesh G. Parikh |           |
| 12. | Jimit D. Desai   |           |
| 13. | Bharat Kadakia   |           |
| 14. | Rushil M Kadakia |           |

**TEAM - A4**

**No. Name of Player**

|     |                          |
|-----|--------------------------|
| 1.  | Anand B Shroff (Cap.)    |
| 2.  | Sumil M. Kadakia (V.Cap) |
| 3.  | Paresh R. Parikh (WK)    |
| 4.  | Sanjeev K. Dharia        |
| 5.  | Raj D. Sheth             |
| 6.  | Chirag V. Modi           |
| 7.  | Nishith S Parikh         |
| 8.  | Archies J. Modi          |
| 9.  | Chetan J Kadakia         |
| 10. | Sachin P Parikh          |
| 11. | Jayesh R shah            |
| 12. | Nilpesh V. Modi          |
| 13. | Rohan J. Desai           |
| 14. | Rahil Kadakia            |

**GROUP - B**

**Nitin R. Gandhi Group**

**Team - B1**

**No. Name of the Player**

- |                      |           |
|----------------------|-----------|
| 1. Ravish M. Desai   | (Cap.)    |
| 2. Ritesh B. Kadakia | (V. Cap.) |
| 3. Praful N. Dharia  | (Wk)      |
| 4. Nirav J. Desai    |           |
| 5. Nitin P. Gandi    |           |
| 6. Ketan J. Kadakia  |           |
| 7. Chirag N. Desai   |           |
| 8. Devang V. Parikh  |           |
| 9. Niketu J. Shah    |           |
| 10. Rahil K. Modi    |           |
| 11. Utsav P. Modi    |           |
| 12. Jatin N. Desai   |           |
| 13. Anik N. Desai    |           |
| 14. Arpit Sheth      |           |

**Team - B2**

**No. Name of the Players**

- |                        |           |
|------------------------|-----------|
| 1. Apurva D. Dharia    | (Cap.)    |
| 2. Ruchit H. Doshi     | (V. Cap.) |
| 3. Chirag C. Parikh    | (Wk.)     |
| 4. Niren K. Dharia     |           |
| 5. Samir C Desai       |           |
| 6. amit J. Kadakia     |           |
| 7. Alkesh M. Kadakia   |           |
| 8. Prakash S. Parikh   |           |
| 9. Bandish Shah        |           |
| 10. Sahil R. Kadakia   |           |
| 11. Dhirubhai R. Sheth |           |
| 12. Sandeep N. Parikh  |           |
| 13. Chirag K. Kapadia  |           |
| 14. Jimit S. Parikh    |           |

**Team - B3**

**No. Name of the Players**

- |                        |            |
|------------------------|------------|
| 1. Shiten D. Kadakia   | (Cap.)     |
| 2. Chirag D. Dharia    | (Wk. Cap.) |
| 3. Samir R. Desai      |            |
| 4. Jigar K. Parikh     |            |
| 5. Nirav D. Kadakia    |            |
| 6. Saurin N. Parikh    |            |
| 7. Rajul M. Parikh     |            |
| 8. Nishant N. Gandhi   |            |
| 9. Piyush C. Parikh    |            |
| 10. Karan R. Parikh    |            |
| 11. Sunil N. Kacheria  |            |
| 12. Saishav V. Shah    |            |
| 13. Darshan H. Parikh  |            |
| 14. Vasantbhai D. Shah |            |

**Team - B4**

**No. Name of the Players**

- |                      |          |
|----------------------|----------|
| 1. Ankit Parikh      | (Cap.)   |
| 2. Sahil N. Desai    | (V. Cap) |
| 3. Chirag J. Desai   |          |
| 4. Sanjay K. Modi    |          |
| 5. Kamil P. Sheth    |          |
| 6. Rahul T. Parikh   |          |
| 7. Samir J. Dharia   |          |
| 8. Mitesh N. Dharia  |          |
| 9. Pankaj O. Kadakia |          |
| 10. Miten Parikh     |          |
| 11. Sachit S. Parikh |          |
| 12. Praful P. Dharia |          |
| 13. Jasmin B. Sheth  |          |
| 14. Anish N. Shah    |          |



## શ્રી બા.ન. સંઘ સંચાલિત શ્રીમતી શાંતાબેન કંતિલાલ દોશી પુરસ્કૃત મહિલા વિભાગ

૨૦ ઓગસ્ટ શુક્રવારે B.C.A. ગરવારે કલબમાં ડૉક્ટરોનો સેમીનાર જેમાં વેરીકોન વેર્ન્સ થવાનું કારણ શું અને તેના ઉપાય શું તેના માટે ડૉ. આનંદ સોમૈયાએ ખૂબ જ ઉપયોગી ટીપ્સ સાથે જાણકારી આપી હતી. તેમજ ગાયનેક ડૉ. પ્રશાંત મંગેશકર લેડીસોને ગર્ભશય ગાંઠ થઈ હોય તેવા વિષેની માહિતી સ્લાઇડ ઉપર બતાવીને સમજાવ્યું હતું. ડૉ. અનિશ દલાલે કેન્સર વિશેની જાણકારી આપી દરેકના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા અને છેલ્લે ડૉ. તીલોત્તમા મંગેશકરે ઈમરજન્સી ઈન હોમ માટે દરેક ઈમરજન્સી વખતે ઘરમાં હોઈએ ત્યારે ડૉ. પાસે પહોંચીએ તે પહેલા શું પગલા લેવા તેના વિશે માહિતી આપી હતી આમ ઉપયોગી ટીપ્સ અને દરેકના સવાલના જવાબ સાથે પ્રોગ્રામ પતાવ્યો હતો. પછી દરેકે નાસ્તાને (ઇડલી-સાંભાર-ચટણી તેમજ બટાટાવડા અને કોકિંકસ)ને ન્યાય આપી વિદાય લીધી હતી.

સપ્ટેમ્બર મહિનાની ૨૪મી શુક્રવારે લહાણી પાસ મંડળની ઓફિસમાં ઉ થી ૫ ના સમયે આપવામાં આવશો. ૨૫-૨૬ સપ્ટેમ્બર માથે રાન પીકનીક કપલ્સમાં રાખવામાં આવી છે. એક જણાના રૂ. ૫૦૦/-

- “સાવ સાચુ બોલુ હું” - તેની પ્રતિજ્ઞા લઈને બોલનારાઓ જ મોટે ભાગે પોતાના જૂઠાણા પર પ્રતિજ્ઞાનો વ્હાઈટવોશ કરતા હોય છે.
- માનવ જીવનનો તાગ પામવો એ ઘાસની ગંજમાંથી સોય શોધવા જેવું દુષ્કર કાર્ય છે.

- દોઢ દિવસની પીકનીક રાખવામાં આવી છે. બીજે દિવસે બપોરે ચા-નાસ્તો કરી નીકળવાનું છે. જેને નામ લખાવવું હોય તે રત્નાબેનને ફોન કરી જણાવી દે. વધારાની માહિતી આગલા જ્યોતિપુંજમાં આપી છે.

લહાણીની વસ્તુ તથા પૈસા કોઈપણ કમીટીની બહેનો પાસેથી અથવા તો રત્નાબેન પાસેથી જાણી શકશો. લહાણીના પાસ લેવા માટે તમારા આઈ કાર્ડ પર સાઈન લેવી જરૂરી છે.

સંયોજક - રત્ના કડકીયા

## શ્રી વાડાસિનોર ગોકુલેશ સમાજ, મુંબઈ

તા. ૨૨.૮.૨૦૦૪ના દિવસે શ્રી વાડાસિનોર ગોકુલેશ સમાજની આઈમી વાર્ષિક સામાન્ય સભા લાડની વાડીમાં મળી હતી. દરવર્ષ સમાજ તરફથી ઉજવાતા શ્રી મહાઓચ્છવ, શ્રી ફગવા ઉત્સવ તથા શ્રી પ્રવચન માટે પાંચ વર્ષ માટેના પાંચ -પાંચ મનોરથીઓ માટેની ટહેલ નાંખી હતી. તેનો ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો. હાજર રહેલા બધા જ પ્રકૃતિલિત થઈ ગયા.

જ્યાં તૈ હજાર માર્ગા હતા ત્યાં સત્તાવન હજાર મળ્યા. દાતાઓએ ઉદારતાનો પરચો આપી દીધો. આવા બારે પ્રસંગના બાર દાતાઓનું અમો સ્વાગત કરીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. આપણા સમાજમાં આવા સખી દિલના દાતાઓની ખોટ નથી.

શ્રી રસીકલાલ મહીલાલ પરીખ (લાકડાવાલા) તથા તેમના પરિવારના સભ્યોએ પાંચ મહાઓચ્છવ તથા પાંચ પ્રવચન માટેના મનોરથી બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ચાલુ સાલનો ફગવો તથા એક વર્ષ માટેના પ્રવચન માટેના મનોરથી બનવાનું સદ્ભાગ્ય શ્રી કાંતિલાલ લાલચંદ દોશીને પ્રાપ્ત થયું છે. સમાજ આ બધા જ દાતાઓનો હૃદયપૂર્વક આભાર માને છે.

હવે માત્ર ફગવા માટેના ચાર મનોરથીઓ લેવાના બાકી રહે છે. જે કોઈ ભાઈ-બહેનને ફગવાના મનોરથી થવું હોય તેઓ શ્રી નવનીતભાઈ સરકારનો સંપર્ક સાધે. એજ વિનંતિ.

લી.

મંત્રી - નવનીતલાલ ચંદુલાલ પરીખ (સરકાર)

જ્યોતિપુણ્ય

સપ્ટેમ્બર' ૨૦૦૪

સહર્ષ જણાવવાનું કે શ્રીમતી કુસુમબેન રસિકલાલ તેમજ રસિકલાલ મહીલાલ લાકડાવાળા પબ્લિક ચેરિટેબેલ ટ્રસ્ટ તરફથી ઉપયુક્ત મંડળને રૂ. ૧૬૦૧૬/- દાન રૂપે મળેલ છે. આમ આ ટ્રસ્ટની કુલ રકમ રૂ. ૧૪૧૧૪૧/- થવા જાય છે.

મંડળના સર્વે કાર્યકર્તાઓ, ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રસિકલાલ મહીલાલ લાકડાવાળાનો હૃદયપૂર્વક આભાર માને છે.

- અસીત રમેશચંદ્ર દેસાઈ

કિરીટ રમકાલાલ કરકીયા (મલમ)

## જનતા સ્કોલશીપ યોજના હેઠળની ફી સહાય

વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે હર વર્ષની શ્રી વાડાસિનોર ગોકુલેશ સમાજની આવી છે. તે હેઠળ જરૂરતમંદ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને સંધની ઓફિસમાંથી ફોર્મ લઈ જઈ સંપૂર્ણ વિગતો ભરી, વાલીની સહી લઈ ઓફિસમાં તા. ૩૦.૮.૨૦૦૪ પહેલાં આપી જવા વિનંતી.

ફોર્મની વિગતો સંપૂર્ણ ભરવી જેથી કરીને ફી સહાય મેળવવામાં વિલંબ ન થાય. આ આપણા સમાજ તરફથી આપવામાં આવતી સહાય છે. તેથી જરૂરિયાતવાળાઓ તેનો અવશ્ય લાભ લેશે તેવી આશા.

ફોર્મ મેળવવાનું સ્થળ : ચંદ્રેશ અન્ટરપ્રાઈઝ, શોપ નં.-૧૭, દેવકરણ મેન્શન, પાઠક વાડી, લુહાર ચાલ, મુંબઈ - ૨

- પ્રદીપ કરકીયા-મંત્રી

સતીશચંદ્ર ભી. પરીખ (રોકડીયા), સંયોજક

સહર્ષ જગ્યાવવાનું કે 'શ્રીમતી કુસુમબેન અને શ્રી નવનીતલાલ રમણલાલ કડકીયા (લટકારી) ફાઉન્ડેશન'ને ચેરિટી કમીશનર તેમજ આકારણી વિભાગ તરફથી માન્યતા તેમજ ૮૦ -જી, સિટ્ટફિકેટ પ્રાપ્ત થતા આ ફાઉન્ડેશન ટ્રસ્ટ કાર્યરત થઈ ચૂકેલ છે.

જ્ઞાતિના ભાઈ-બહેનો તેમજ સખાવતી દાતાઓને આ ટ્રસ્ટની નોંધ લેવા વિનંતી.

આ ટ્રસ્ટના ટ્રસ્ટ ફંડની આવક શૈક્ષણિક સહાય માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ઉપયુક્ત મંડળની ૮૦મી વાર્ષિક સામાન્ય સભા શુક્વવાર તા. ૨૪.૬.૨૦૦૪ના રોજ સાંજના ૬.૩૦ કલાકે શ્રી બાલાસિનોર પ્રગતિ સમાજની ઓફિસ ખાતે યોજવામાં આવેલ છે. સર્વે સભ્ય ભાઈ બહેનોને આ બાબતની નોંધ લઈ સમયસર હાજર રહેવા વિનંતિ.

- અસીત રમેશચંદ્ર દેસાઈ

કિરીટ રમણલાલ કડકીયા (મલમ)

તા. ૨૦.૬.૨૦૦૪ના સોમવારે સાંજે ૩.૩૦ કલાકે શ્રી બાલાસિનોર પ્રગતિ સમાજની ઓફિસમાં યોજવામાં આવી છે. સર્વે સભ્યોને હાજર રહેવા વિનંતી

- મંત્રીઓ - પ્રવીણ દેસાઈ

- પરાજયની કાણો "વરવો" ન બને અને વિજયની ધરીએ "ગરવો" અને "નરવો" રહે એવા જિંદાદીલ માણસ કામયાબ ગણાય છે.

- ૧) ૧,૨૫,૦૦૦.૦૦ એક લાખ પચ્ચીસ હજાર પુરા શ્રી બાબુલાલ ચંદુલાલ શાહ (પડાલવાલા)
  - ૨) ૧,૦૦,૦૦૦.૦૦ એક લાખ પુરા શ્રીમતી ઈન્દીરાબેન હરીશ ગાંધી
  - ૩) ૧,૦૦,૦૦૦.૦૦ એક લાખ પુરા શ્રીમતી રક્ષાબેન સતીષકુમાર મોદી
- ૭૫ વર્ષ ઉજવણીપર્વ પણી મળેલા દાન મટેના વચનો બદલ મંડળ વતી ઉપરોક્ત દાતાઓનો તથા તેમના કુટુંબીજનોનો આભાર.

કે.એ.મ.જી. ટ્રસ્ટ સંચાલિત કલાવતીબેન કાંતીલાલ મહેતા આર્યુવેદિક ઔષધાલય, બાલાસિનોર ખાતે ઘણા વર્ષોથી આર્યુવેદિક સારવારની સેવાઓ કરી રહેયે હોય. એટા કાંતીલાલ મહેતા આર્યુવેદિક સારવારની આપા કાંતીલાલ મહેતા આર્યુવેદિક સારવારની જનતા, બહારણામના દર્દીઓ તથા મુંબઈથી આવતા લોકોએ પણ પ્રાપ્ત કરેલ છે. કેટલાકને સારવારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. દર્દીઓની સંખ્યા તથા સંતોષકારક પરિણામો પણ વધારે થયેલ છે. આજના ઝડપી યુગમાં પ્રાકૃતિક એવી આર્યુવેદિક પદ્ધતિની સારવારથી ચોક્કસ લાભ થાય છે અને સૌઅં તેમાં વિશ્વાસ રાખી જરૂર પડે તેના શરારો જવુ યોગ્ય છે. ઔષધાલય ખાતે એક્યુપંક્યર સેવાઓ પણ ઉપલબ્ધ છે જે વૈદ્યશ્રી દ્વારા આપવામાં આવે છે. હાલમાં એક્યુપેશર, મેનોટોથેરાપી, રેકી વગેરે દ્વારા સારવારની સેવાઓ શ્રી કનુભાઈ ધારીયા (અણીયાદવાળા) દ્વારા તેજ સ્થળે આપવામાં આવે છે. જે ડીસેમ્બર'૦૪ના અંત સુધી મળી રહેશે.

મંત્રીઓ

બાલાસિનોર કોલેજના પ્રમુખશ્રી નટવરલાલ સી. પરીખના સુપુત્ર ગૌરાંગભાઈએ તેમનાં માતુશ્રી સુશીલાબેનની પુષ્યતિથિ નિમિત્તે આપેલા રૂ. ૫ લાખના દાનમાંથી બનાવેલ અધ્યતન લેંગવેજ લોબોરેટરી વિદ્યામંડળના ઉપપ્રમુખશ્રી મહિકાન્તભાઈ કડકીઆએ કોલેજને સમર્પિત કરી. આરંભમાં આચાર્ય શ્રી મુનભાઈ પાઠકે સૌનો આવકારી દાતાનો આભાર માન્યો હતો. કોલેજના

તમામ વિષય વિભાગો આ લેબનો સફ્ટપયોગ કરે તેવી પ્રેરણા આપી હતી. લેબોરેટરીના પ્રધાન ઈન્ચાર્જ પ્રા. શૈલેન્ડ ભાવે આ લેબોરેટરી સાકાર કરવામાં સહભાગી સૌનો આભાર માની લેબ-સમિતિના સૌ સભ્યોની ખાતરી આપી હતી. સમારંભમાં મંત્રી શ્રી રજનીભાઈ, શ્રી કે.વી.શાહ, શ્રી અજયભાઈ શાહ, શ્રી મનુભાઈ ચા વાળા, સૌ અધ્યાપકો, વહિવટી કર્મચારી મિત્રોની પ્રોત્સાહક હાજરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. રજની ભાવે સંભાળ્યું હતું.

બાલાસિનોર કોલેજને લેંગવેજ લોબોરેટરી સમર્પિત કરી



## નવા ફોન નંબર



### નવા સરનામાં

- ૧) અનીલભાઈ રમણલાલ દેસાઈ (મેનુપુરાવાળા)  
નિમેષ અનીલ દેસાઈ  
ફ્લેટ નં-૬, તૈયકલવાસી કો.ઓ.ડા.સો.લી.  
તૈયકલવાડી, એમ.એન. રોડ,  
પાર્ટી હોટલની પાસે,  
અલડાબાદ બેન્કની બાજુમાં  
ઓફ એલ.જે.રોડ, માહીમ (વેસ્ટ),  
મુંબઈ - ૪૦૦ ૦૧૬
- ૨) કેતન આર કડકીઆ  
બી/૨૪, ૨જનીગંધા બીલ્ડિંગ,  
એમ.સી.એફ. ઉદાન માર્ગ,  
ઓફ એસ.વી.રોડ, બોરીવલી (વેસ્ટ),  
મુંબઈ - ૪૦૦ ૦૯૨  
ફોન : ૨૮૬૫૫૦૩૨
- ૩) પરેશ રસીકલાલ પરીખ (સમાધાની)  
૫૦૧/એ, શ્રીલ્લ કીરણ, તેજપાલ રોડ,  
પંડ્યા કોટેજ, વીલેપાર્વ (ઇસ્ટ),  
મુંબઈ - ૪૦૦૦૫૭,  
ફોન : ૨૬૧૩૧૮૫૫
- ૪) અનીશ પ્રવીણ પરીખ  
સુખમની બિલ્ડિંગ, ૭મે માર્ગ,  
ફ્લેટ નં.-૮૦-બી, બોમનજી પેટીટ રોડ,  
વોર્કન રોડ, મુંબઈ - ૪૦૦ ૦૨૬

૧) રાજુ ગમનલાલ પરીખ

ધર : ૨૨૦૯૬૫૮૨

૨) પરેશ કાન્તીલાલ દેસાઈ  
પ્રતીક પરેશ દેસાઈ

ધર : ૨૮૦૬૩૫૧૮, ૫૬૨૮૮૪૬૮

મોબાઈલ : ૯૮૬૯૯૧૯૮૨૪

૩) અશીન કાન્તીલાલ ધારીઆ (બલબલ)  
મોબાઈલ : ૯૮૨૧૮૦૫૭૧૨

ધારીઆ અશીન ધારીઆ

ધર : ૨૩૫૨૫૮૫૭

મોબાઈલ : ૯૮૨૦૯૨૧૦૩૭

### તેજસ્વી તારલાં

## પ્રક્રિયા વિભાગ

(કશિનાની દક્ષા કો.ઓ.ડા.સો.લી.) ૧૧૭

(પડાલવાળા) બી.ઈ. ઇન્ફોરમેશન ટેકનોલોજી  
ફાઈનલ ઇયરમાં ૬૭ % માર્ક્સ સાથે ઉત્તીર્ણ  
થાય છે. અત્યાર સુધીના દરેક સેમીસ્ટરમાં તેઓ  
ફર્સ્ટ કલાસ સાથે પાસ થાય છે.

૨) આનંદ જયેશકુમાર મોહનલાલ દોશી સી.એ.  
ફાઈનલમાં ૪૫મી રેક સાથે ઉત્તીર્ણ થાય છે.

૩) ઓજસ યોગેશ ધારીઆ મોસ્કો યુનીવર્સિટી ઓફ  
ઇડાહોમાંથી એમ.એસ. (ઇલ્ક્રોનિક્સ)માં ઉચ્ચ

બાલાસિનોર વાસીઓની સગવડ માટે વધુ એક પ્રયાસ જ્યોતિપુંજના પ્રક્રિયા વિભાગ માટે

E-mail Address - vadsol@balasinor.org

## સમાચાર

- ગ્રેડમાં પાસ થયા છે.
- ૪) હુ. કૃતિ નીલેશ ત્રીવેદી ICSE પરીક્ષામાં ૮૮ % માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે.
  - ૫) મીતુલ વિપુલ ગાંધી B.S. (ઇલેક્ટ્રોનિક)ની સેકન્ડ ઈયરની પરીક્ષામાં ૭૧.૮ ટકા સાથે યુનીવર્સિટીમાં ૨૮માં સ્થાને ઉત્તીર્ણ થયા છે.
  - ૬) અમી સુજાત કડકીઆ (૬૭ %) તથા મેઘા સુજાત કડકીઆ (૭૭.૩%) સાથે માર્સ્ટર્સ ઇન કોમ્પ્યુટર મેનેજમેન્ટમાં ઉત્તીર્ણ થયા છે.
  - ૭) આષિતા જગદીશ મોદી (હૈદરાબાદ) સેકન્ડ ઈયર બી.ટેકમાં ૭૪ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે.
  - ૮) હેમાકી જગદીશ મોદી (હૈદરાબાદ) ફસ્ટ ઈયર (MEC) માં ૮૬% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે. સૌ વિદ્યાર્થી મિત્રોને સંસ્થાવતી ખુબ ખુબ અભિનંદન

## અભિનંદન

શ્રી રાજેન્દ્ર શાંતીલાલ પરીખ (જુનાગઢવાલા) બૃહદ મુંબઈ લાઈસન્સડ પ્લાન્ટમાં એશોસીએશનના પ્રમુખ તરીકે નીમણુંક પામ્યા છે તથા વિપુલ બાબુલાલ ગાંધી કાર્યવાહક સત્ય નીમાયા છે. બાલાસિનોરની કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિને પાણી જેવી બાબતની તકલીફ હોય તો તેઓનો સંપર્ક સાધી નીરાકરણ કરી શકે છે. બસે ભાઈઓને સંસ્થા તરફથી અભિનંદન.

## મૃત્યુ નોંધ

૩.૧૭

- |                                       |    |
|---------------------------------------|----|
| ૧. શાંતાબેન પુનમચંદ કડકીઆ (હાલોલવાળા) | ૮૦ |
| ૨. મોહનલાલ છોટાલાલ શેઠ (અત્તરવાલા)    | ૮૮ |
- પ્રભુ સદ્ગતના આત્માને શાંતિ અર્પે.

કાંદિવલીમાં વસતા બાલાસિનોરવાસીઓનું ત૦માં વર્ષનું સમુહભોજન તા. ૧૮.૬.૨૦૦૪ના શનિવારના રોજ (ગણેશ ચતુર્થી) કેવલબાગ, કિલાચંદ રોડ, ફલાય ઓવરની બાજુમાં કાંદિવલી (પણ્ણિમ) ખાતે સવારે ૧૧ કલાકે રાખવામાં આવ્યું છે.

## પુસ્તક વસાવી કીડની હોસ્પીટલને મદદ કરો

આપણી કે.એમ.જી. હોસ્પીટલમાં સેવા આપતાં ડૉ. વી. એફ. શાહના પુત્રી શ્રીમતી સોનલ મોદી દ્વારા મનની વાત પુસ્તક પ્રકટ કરવામાં આવ્યું છે. ઈન્ફોસીસના શ્રીનારાયણ મૂર્તિના પત્ની શ્રીમતી સુધા મૂર્તિ દ્વારા તેઓના સેવાના કાર્ય દરમ્યાન થયેલા વિવિધ અનુભવોની વાતો ગુજરાતીમાં સુંદર અનુવાદ કરીને આ પુસ્તક પ્રકટ થયું છે. માનવીઓના વિવિધ પ્રસંગોનો ઝાંખાં આપતાં આ પ્રસંગોના આદ્યખનેવાળું પુસ્તક “મનની વાત વાચવા” અને વસાવવા લાયક પુસ્તક છે. આ પુસ્તકની બધી જ આવક અમદાવાદની કીડની હોસ્પીટલમાં આપવામાં આવનાર છે. (ચિત્રલેખામાં પણ આની નોંધ લેવાઈ છે) તો બાલાસિનોરવાસીઓને આ પુસ્તક ખરીદી કરીને અને ભેટ આપીને સારા કાર્યમાં સાથ આપવા અનુરોધ.

ગામના વધુને વધુ લોકો દિવાળીનો ઉત્સવ બાલાસિનોરમાં ઉજવે એ ઉમદા હેતુ સાથે વડીલો દ્વારા તારીખ ૮.૧૧ થી ૧૭.૧૧ સુધી જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે. સૌને તેનો લાભ લેવા અને ગામમાં દિવાળી ઉજવવા આમંત્રણ છે.

- બાળુભાઈ પરીખ (મલમ)

# બાલાસિનોર વિદ્યા મંડળ

## સામાન્ય સભાની નોટીસ

તા. ૧૮.૮.૨૦૦૪

સુશ્રી મહાશય,

ઉપરોક્ત મંડળની છત્રીસમી વાર્ષિક સામાન્ય સભા નીચે જણાવેલ સ્થળે અને સમયે રાખવામાં આવી છે, તો આપશ્રીને હાજર રહેવા વિનંતી છે.

### કામકાજની યાદી

- ૧) ગત વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી મંજૂર કરવા બાબત
- ૨) સને ૨૦૦૩-૨૦૦૪ વર્ષના મંત્રીશ્રીના નિવેદનની નોંધ લેવા બાબત
- ૩) સને ૨૦૦૩-૨૦૦૪ વર્ષના મંડળના ઓડીટોર હિસાબો મંજૂર કરવા બાબત.
- ૪) સને ૨૦-૦૪-૨૦૦૫ વર્ષના મંડળના અંદાજપત્રને મંજૂર કરવા બાબત
- ૫) કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી પરિણામની નોંધ લેવા બાબત.
- ૬) મંડળના ઓડિટરની સને ૨૦૦૪-૨૦૦૫ વર્ષ નિમણ કરીતે મનું વેતન નક્કી કરવા બાબત.
- ૭) પ્રમુખશ્રીની અનુમતિથી જે રજૂ થાય તે.

સામાન્ય સભાની તારીખ : બુધવાર, તા. ૧૮.૮.૨૦૦૪

સામાન્ય સભાનો સમય : સાંજના ૪.૦૦ બંદ્લાકે

સભાનું સ્થળ : બાલાસિનોર વિદ્યામંડળ ઓફિસ, જૈન દેરાસર પાસે,  
ભંગવાડા, બાલાસિનોર

### લિ. મંત્રીઓ

કાન્તિલાલ વીરચંદ શાહ

યંડકાન્ત ચીમનલાલ દેસાઈ

ઉશનસ નવીનચંદ કચેરીઆ

રજનીકાન્ત ઓચ્છવલાલ શાહ

દેસાઈભાઈ મોતીભાઈ પટેલ

નોંધ : કોરમના અભાવે સામાન્ય સભા મુલત્વી રહેશે તો બંધારણા  
મુજબ તેજ દિવસે તે જ સ્થળે અડધા કલાક થાટ સભાનું  
કામકાજ શરૂ કરવામાં આવશે અને તે વિધિસરનું ગણાશે.